



જનસંપર્ક અધીકારી દ્વારા

પોલીસ કમિશનરશ્રીની કચેરી, અમદાવાદ શહેર

ટેલીફોન નંબર ૨૫૬૩૩૩૩૩



કંટ્રોલરૂમ ટેલી.નં. ૨૫૬૩૦૧૦૦, ૨૫૬૩૦૨૦૦, ૨૫૬૩૦૪૦૦ ફેક્સ: ૨૫૬૩૦૬૦૦

તા.૨૨/૦૮/૨૦૧૯ ગુરૂવાર

અમદાવાદ શહેર પોલીસ સમાચાર

નશાબંધી તથા જુગાર ધારા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૧૫/૧૯

શહેર પોલીસે ગઈકાલે નશાબંધી ધારા હેઠળ ૪૦ કેસ કરી, ૩૯ વ્યક્તિઓને ઝડપી, ૧૪૧ લીટર દેશી દારૂ, ૧૫ બોટલ ઇંગ્લીશ દારૂ, ૪૫૧ ક્વોટર ઇંગ્લીશ દારૂ, ૪૮ બીયરટીન, ૧ રિક્ષા અને ૧ મોટર સાયકલ કબજે કરી હતી. તેમજ જુગાર ધારા હેઠળ ૨૩ કેસ કરી, ૧૩૭ વ્યક્તિઓને ઝડપી રોકડ રૂપિયા ૩,૫૮,૨૫૦/- અને જુગારના સાધનો કબજે કર્યા હતા.

તકેદારીના પગલા હેઠળ ઝડપાયા:-

સમાચાર યાદી નં.૧૪૧૬/૧૯

શહેર પોલીસે ગઈકાલે તકેદારીના પગલા હેઠળ સી.આર.પી.સી.૧૦૭,૧૦૮,૧૧૦,૧૫૧ મુજબ કુલ ૭૪ વ્યક્તિઓની અને પ્રોહી.૯૩ મુજબ ૦૨ વ્યક્તિઓની અટકાયત કરી હતી.

ઝુંટ :-

સમાચાર યાદી નં.૧૪૧૭/૧૯

શહેરકોટડા : રમનકુમાર રાધેલાલ શર્મા (ઉ.વ.૪૬)(રહે.આવાસ પાર્ક નરોડા કોસિંગ) એ તા.૨૧/૮/૧૯ ના રોજ શહેરકોટડા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૯/૦૮/૧૯ ના કલાક ૦૦/૧૫ વાગ્યાના સુમારે ઓટોરીક્ષામાં આવેલ ચાર અજાણ્યા ઇસમો (૨૨ થી ૨૫ વર્ષના આશરાના)એ ભેગામળી રમનકુમાર ને કાલુપુર થી રિક્ષામા બેસાડી વિજયમીલના નાળીયા માં લાવી, રમનકુમારનું લેપટોપ કિંમત રૂપિયા ૪૦,૦૦૦/- તથા રોકડ રૂપિયા ૨,૨૦૦/- ડ્રાઇવીંગ લાયસન્સ, ચુટણી કાર્ડ, પાનકાર્ડ મુકેલ તે પર્સ અને મોબાઇલ કિંમત રૂપિયા ૮,૦૦૦/- જે તમામ રમનકુમાર પાસેથી ઝુંટવી લઇ નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એમ.આઇ.ચૌધરી ચલાવે છે.

ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૧૮/૧૯

એલીસબ્રીજ : દિપ્તિબહેન વા/ઓ નરેશકુમાર ભટ્ટ (ઉ.વ.૪૭)(રહે.અક્ષરધામ સોસાયટી, વિકાસનગર-૨, મથુરાનગરી ની પાસે, જુના વડોદરા રોડ, વડોદરા શહેર) એ એલીસબ્રીજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૮/૧૯ ના કલાક ૧૦/૩૦ વાગ્યાના સુમારે પાલડી વી.એફ.એસ. કેનેડા ઇમીગ્રેશનની ઓફીસ પાસે રોડ ઉપર તેઓની કારમા બેઠા હતા અને કારના દરવાજા ખુલ્લા હતા દરમ્યાન કાર નજીક આવેલ એક અજાણ્યો પુરૂષ (૨૦ થી ૨૫ વર્ષના આશરાનો) દિપ્તિબહેનને જણાવેલ કે “તમારા પૈસા કારની પાછળ નીચે પડેલ છે, તમે લઇ લો” તેમ કહેતા દિપ્તિબહેન કારની નીચે ઉતરી પાછળ જોવા ગયેલ દરમ્યાન અજાણ્યા પુરૂષ સાથે આવેલ તેના બીજા મળતીયા ઇસમે દિપ્તિબહેનની નજર ચૂકવી તેમની કારમાંથી રોકડ રૂપિયા ૧,૦૦,૦૦૦/- અને અગત્યના દસ્તાવેજો મુકેલ પર્સ ની ચોરી કરી નાસી ગયા હતા. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી એસ.જી.ખાંભલા ચલાવે છે.

રાણીપ : જયદેવ પ્રકાશભાઈ જાસ્કર (ઉ.વ.૪૧)(રહે.શિવમ પ્રાયોરી એપાર્ટમેન્ટ મકરબા ટોરેન્ટ પાવર સબ સ્ટેશનની સામે સરખેજ) એ રાણીપ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૦૮/૧૯ સાંજના ૫/૩૦ થી ૫/૪૫ વાગ્યા દરમ્યાન રાણીપ સુભાષબ્રિજ કલેક્ટર કચેરીના પાર્કિંગમાં પાર્ક કરેલ પોતાની ફોર વ્હિલ કારની પાછળની સીટના દરવાજાનો કાચ તોડી, અજાણી વ્યક્તિ કારની ડ્રાઇવર સીટની બાજુની સીટ નીચે મુકેલ રોકડ રૂપિયા ૧૪,૫૦,૦૦૦/- ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.ઇ.શ્રી જે.જી.પટેલ ચલાવે છે.

રખિયાલ : હર્ષાબહેન બાબુભાઈ રાહોડ (ઉ.વ.૨૮)(રહે.ગામ: થાન તા.ચોટીલા જી.સુરેન્દ્રનગર) એ રખિયાલ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૨૧/૮/૧૯ ના કલાક ૧૧/૦૦ થી ૧૧/૩૦ વાગ્યા દરમ્યાન સારંગપુર થી રખિયાલ ચાર રસ્તા સુધીની ઓટોરીક્ષાની મુસાફરી દરમ્યાન ઓટોરીક્ષા ચાલક અને રીક્ષામાં બેસેલ બે પુરુષ એ ભેગામળી હર્ષાબહેનની નજર ચૂકવી તેમના થેલામાંથી રોકડા રૂપિયા ૧૨,૦૦૦/- તથા સોનાનુ મંગળસુત્ર કિંમત રૂપિયા ૩૫,૦૦૦/- મળી કુલ રૂપિયા ૪૭,૦૦૦/- મતાની ચોરી કરી હર્ષાબહેનને ઓટોરીક્ષામાંથી નીચે ઉતારી નાસી ગયા છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી કે.એન.વાઘેલા ચલાવે છે.

વાહન ચોરી :-

સમાચાર યાદી નં.૧૪૧૯/૧૯

સરખેજ : આદમભાઈ મહંમદભાઈ વડદરીયા (ઉ.વ.૪૫)(રહે.તૌફીક ડુપ્લેક્ષ, બાગે તબ્સુમ સોસાયટી સામે, એમ.એન. રો-હાઉસ ટાવર પાસે, ફતેવાડી) એ તા.૨૧/૮/૧૯ નારોજ સરખેજ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ નોંધાવી છે કે તા.૧૬/૦૮/૨૦૧૯ રાતના ૯/૩૦ થી ૧૦/૩૦ વાગ્યા દરમ્યાન સરખેજ એસ.જી.હાઇવે સંન્યાસ આશ્રમ પાસે આવેલ પે એન્ડ યુઝ શૌચાલયની સામે રોડની સાઇડમાં પોતાની આઇશર-૧૧૧૦ ગાડી નંબર જીજી.૧૬.ડબલ્યુ.૬૨૩૭ કિંમત રૂપિયા ૫,૫૦,૦૦૦/- પાર્ક કરી મુકી હતી. જેની કોઇ અજાણી વ્યક્તિ ચોરી કરી લઇ ગઇ છે. આ ગુનાની તપાસ પો.સ.ઇ.શ્રી જે.કે.પંડ્યા ચલાવે છે.

નાયબ પોલીસ કમિશનર,
કંટ્રોલરૂમ, અ'વાદ શહેર.
પોલીસ કમિશનર વતી.